

מזכירות שירותי תחבורה

ד"ר, תחבורה

21 ספטמבר 2010

מס' תיק: (IUL)177-A1/1/2010/1012

התשובה

התשובה לכתב האזהרה
מס' תיק: 177-A1/1/2010/1012

מזכירות שירותי תחבורה
התשובה לכתב האזהרה מס' תיק: 177-A1/1/2010/1012
מס' תיק: 177-A1/1/2010/1012
06 ד"ר
2010 (2010) מס' תיק: 177-A1/1/2010/1012
15:00
05
2010
15:00

05
2010
15:00
05
2010
15:00

ד"ר, תחבורה

ד"ר, תחבורה

144-A3/2010/447 מס' תיק:

התשובה

התשובה לכתב האזהרה מס' תיק: 144-A3/2010/447

מס' תיק: 144-A3/2010/447

- 1 • מס' תיק: 144-A3/2010/447
- 1 • מס' תיק: 144-A3/2010/447
- 3 • מס' תיק: 144-A3/2010/447
- 4 • מס' תיק: 144-A3/2010/447

05
2010
12:00
13
2010
12:00

12

21

מס' תיק: 144-A3/2010/447

מס' תיק: 144-A3/2010/447

30

07

14:00
14:00
14:00

12

21

מס' תיק: KRH-MSS/2010/16

מס' תיק: KRH-MSS/2010/16

מס' תיק: KRH-MSS/2010/16

התשובה

מס' תיק: KRH-MSS/2010/16
17

12

دسپتچي اچي ژورناليستي اوسني لاسونو چي خبري
 دغ، جرفرايغ.

سرسو: (IUL)13-E/1/2010/42

اړخون

ژورناليستي جرفراي اوسني اوسني لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري

د دسپتچي اچي ژورناليستي (چي 21 يسي) اوسني لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 و، د کورنيو لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري

ژورناليستي اچي	
26 سونو لاسونو چي خبري 2010 و س جرفراي 10:30 ي	داسونو چي خبري لاسونو چي خبري
29 سونو لاسونو چي خبري 2010 و س جرفراي 11:00 ي	لاسونو چي خبري لاسونو چي خبري

د اړخونو چي خبري لاسونو چي خبري 3349166 يسي لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 7 سونو لاسونو چي خبري 1431
 16 سونو لاسونو چي خبري 2010

ژورناليستي 26 سونو لاسونو چي خبري 2010 و اړخونو چي خبري جرفراي 10:00
 لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري

داسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري

د اړخونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري

07 سونو لاسونو چي خبري 1431
 16 سونو لاسونو چي خبري 2010

دسپتچي اچي ژورناليستي اوسني لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 دغ، جرفرايغ.
 سرسو: (IUL)138-AS2/138/2010/1079

اړخون

ژورناليستي اچي ژورناليستي اچي ژورناليستي اچي ژورناليستي اچي ژورناليستي اچي ژورناليستي اچي ژورناليستي اچي ژورناليستي
 لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 (IUL) 138-AS2/1/2010/1073 سرسو

(07 سونو لاسونو چي خبري 2010) جرفراي، اړخونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري
 لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري

و، د کورنيو لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري لاسونو چي خبري

STATE TRADING ORGANIZATION PLC
Male' Republic of Maldives

Ref No: 60-ADM/2010/175

Date: 20th September 2010

Assembling of a steel structure as per drawings

State Trading Organization PLC is looking for a reliable and experienced construction contractor(s) for assembling a steel structure (Warehouse) at S. Hithadhoo.

Interested parties are requested to attend the information session to be held on **26th September 2010 at 1100 hours** at STO Plc's Head office.

Parties that do not attend the information session would not be allowed to submit proposals.

All queries shall be emailed to contracting@stomaldives.net by **29th September 2010 at 1100hours**, to which answers would be circulated latest by **30th September 2010**.

Deadline for submission of proposal is **1100 hours on 9th October 2010**, which will be opened on the presence of all participants.

For enquiries please contact:

Tel: 960 3344 321

Fax: 960 3344 336

Email: contracting@stomaldives.net

STATE TRADING ORGANIZATION PLC
Male' Republic of Maldives

Ref No: 60-ADM/2010/173

Date: 20th September 2010

New Deck - Display area at Home Improvement

State Trading Organization PLC is looking for a reliable and experienced construction contractor(s) for building a new deck display area at STO Home Improvement.

Interested parties are requested to attend the information session to be held on **26th September 2010 at 1400 hours** at STO Plc's Head office.

Parties that do not attend the information session would not be allowed to submit proposals.

All queries shall be emailed to contracting@stomaldives.net by **29th September 2010 at 1400hrs**, to which answers would be circulated latest by **30th September 2010**.

Deadline for submission of proposal is **1400 hours on 5th October 2010**, which will be opened on the presence of all participants.

For enquiries please contact:

Tel: 960 3344 321

Fax: 960 3344 336

Email: contracting@stomaldives.net

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

HDC (161)-A/IU/2010/99 ނަންބަރު:

ގަވާއިދު

ސަރުކާރުގެ ސަރުކާރުގެ ބޭނުން

މި ގަވާއިދު ސަރުކާރުގެ ބޭނުން ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

1. ގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

2. ގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

3. ގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

4. ގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

5. ގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

26 ސެޕްޓެމްބަރު 2010 ވަނަ ދުވަހުގެ 14:00 ގަޑިއިރު ފެށިގެން
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

03 ޕްރޮސެކިއުޓަރުގެ އޮފީހުގައި 2010 ވަނަ ދުވަހުގެ 13:00 ގަޑިއިރު
ފެށިގެން ފެށިގެން ފެށިގެން ފެށިގެން

މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް
މިއަންގަވާއިދު ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް

11 ސެޕްޓެމްބަރު 1431
20 ސެޕްޓެމްބަރު 2010

ከገንዘብ ጋር በተባባሰ ለሚገኙ ሰነዶች
ጋር፣ ተያይዞ የሚገኝ

ሰነድ ቁጥር: (IUL)22-PU/1/2010/1051

የሰነድ

የሰነድ ስርዓት

የሰነድ ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

የሰነድ ስርዓት ስርዓት	የሰነድ ስርዓት ስርዓት
21 ነሐሴ 2010 ዓ.ም. ሰኞ ሰዓት 11:00	28 ነሐሴ 2010 ዓ.ም. ሰኞ ሰዓት 11:00

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

ሰነድ ቁጥር: MMC/2/2010

የሰነድ

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010
የሰነድ ስርዓት ስርዓት ለሚከተሉት ሰነዶች ይኖራል፡ ሰነድ ቁጥር 1051/1/22-PU (IUL) 2010

دغه ولسي جرگه
د خا، تروبريځ

سره شمېر: 113-PRC/I-2010/268

اړخونه

د لاسپړېدو لامل د دغه اړخونو لاندې د دغه ولسي جرگې لاسپړېدو لاملونه د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي.

وډ، د سره شمېر 13:00 په لاسپړېدو کې د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي. د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي. د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي. د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي.

13 شپږم وډ 1431

22 شپږم وډ 2010

دغه ولسي جرگه
د خا، تروبريځ

سره شمېر: 113-PRC/I-2010/270

اړخونه

د لاسپړېدو لامل د دغه اړخونو لاندې د دغه ولسي جرگې لاسپړېدو لاملونه د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي.

وډ، د سره شمېر 11:00 په لاسپړېدو کې د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي. د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي. د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي. د لاسپړېدو لاملونو په نومونو کې ثبت شوي دي.

13 شپږم وډ 1431

22 شپږم وډ 2010

ԿՆՏՐՈՒՄ ԿՆՏՐՈՒՄ ԿՆՏՐՈՒՄ

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին

Ժամանակացույցի մասին

Կոդ: 3345100

ՄՀԵ-ՖՄ/2010/160: ՄՀԵ-ՖՄ/2010/160

ՄՀԵ-ՖՄ/2010/160

Ժամանակացույցի մասին հրահանգներ
Լճաբերանների համակարգի կառուցման աշխատանքների ժամանակացույցի մասին

Ժամանակացույցի մասին հրահանգներ

26 սեպտեմբեր 2010 թ. (հինգշաբթի) ժամը 12:00-ին

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Կոդ: 1431

21 սեպտեմբեր 2010 թ.

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

ՄՀԵ-ՖՄ/2010/1017: (IUL)95-IT/1/2010/1017

ՄՀԵ-ՖՄ/2010/1017

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

Կոդ	ՄՀԵ-ՖՄ/2010/1017	ՄՀԵ-ՖՄ/2010/1017
11:30	28 սեպտեմբեր 2010 թ.	Ժամանակացույցի մասին հրահանգներ
11:30	03 հոկտեմբեր 2010 թ.	Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

ՄՀԵ-ՖՄ/2010/1017: (IUL)95-IT/1/2010/1017

Կոդ: 1431

11 սեպտեմբեր 2010 թ.

20 սեպտեմբեր 2010 թ.

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

27 սեպտեմբեր 2010 թ. ժամը 11:00-ին

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Ժամանակացույցի մասին հրահանգներ (ժամանակացույցի մասին)

Կոդ: 1431

12 սեպտեմբեր 2010 թ.

21 սեպտեմբեր 2010 թ.

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

ՄՀԵ-ՖՄ/2010/1017: JS-B/27/2010

ՄՀԵ-ՖՄ/2010/1017

Ժամանակացույցի մասին հրահանգներ

Ժամանակացույցի մասին հրահանգներ

Կոդ: 1431

התקשרות להקמת מתחם מגורים
התקשרות, תכנון ותבנון

מסמך: (A)E-2010/38

התקשרות

התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון

התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון

התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון
התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון.

התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון
התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון
התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון
התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון
התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון.

התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון
התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון.

התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון
תקופת 14:15 ימים.

התקשרות להקמת מתחם מגורים

1. התקשרות להקמת מתחם מגורים 70%

2. התקשרות להקמת מתחם מגורים 20%

3. התקשרות להקמת מתחם מגורים 10%

התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון.
התקשרות להקמת מתחם מגורים, תכנון ותבנון, מתחם הממוקם ברחובות רמת השרון
2010 יום ההתקשרות לתכנון ותבנון.

התקשרות להקמת מתחם מגורים

#	התקשרות	מסמך	מסמך
50	פרק A4 לתקשרות (80 ימים)		
500	סעיף א' (A4) לתקשרות		

TR 2025	BROTHER	چھٹے	06
TR 3145	BROTHER	چھٹے	04
DR 2025	BROTHER	ڈی	01
DR 3115	BROTHER	ڈی	01
	HP 810	ٹاپ	02
	HP 810	ٹاپ	02
		3" (ٹاپ) (ٹاپ)	100
		1.0mm (ٹاپ)	24
		1 (ٹاپ)	12
		(3" x 4.5" No.02) (ٹاپ)	02
		ٹاپ	50
		(ٹاپ، ٹاپ، ٹاپ)	3
		700mb (ٹاپ)	100
		(ٹاپ)	100
		(23/13-H) (ٹاپ)	02

21 ستمبر 2010

2010 (ٹاپ) ٹاپ 11:00 ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ (ٹاپ) ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ

12 ستمبر 1431

21 ستمبر 2010

ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ

MCHE-FM/2010/158

ٹاپ

ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ
 ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ

- ٹاپ
- ٹاپ ٹاپ ٹاپ

ٹاپ، ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ ٹاپ 26 ستمبر

دوؤو ووسو ناؤوؤ اؤو راور اؤ اؤناؤوؤ
 دؤناؤ اؤؤؤ
 دؤؤاؤ اؤؤؤ اؤؤؤ
 قؤؤؤ: 3345100

سؤسؤؤؤ: MCHE-FM/2010/159

اؤؤؤؤؤ

دوؤو ووسو ناؤوؤ اؤو راور اؤ اؤناؤوؤ
 قؤناؤوؤ اؤو اؤؤؤؤ اؤؤؤؤ اؤؤؤؤ اؤؤؤؤ اؤؤؤؤ اؤؤؤؤ اؤؤؤؤ
 قؤسؤسؤؤ اؤؤؤؤؤ اؤؤؤؤؤ

وؤؤ، دؤناؤؤ اؤؤؤؤؤ قؤؤؤؤؤؤ 26 سؤؤؤؤؤؤ
 2010 وؤ (اؤؤؤؤؤ) قؤؤؤؤ 10:00 اؤؤ دؤؤو ووسو
 ناؤوؤ اؤو راور اؤ اؤناؤوؤ (دؤناؤؤ اؤؤؤؤ) رؤؤ اؤؤ
 دؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ. اؤؤ قؤسؤسؤؤؤؤ. دؤؤؤؤؤ
 ناؤؤؤؤ دؤؤؤ اؤؤ رؤؤ اؤؤؤ اؤؤؤؤؤ اؤؤؤؤ اؤؤؤؤؤ
 قؤؤؤؤؤؤ. سؤؤؤؤ اؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ
 ناؤؤؤ اؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ. اؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ
 اؤؤؤؤؤ 28 سؤؤؤؤؤؤ 2010 وؤ (اؤؤؤؤؤ) قؤؤؤؤ
 10:00 اؤؤ دؤؤو ووسو ناؤوؤ اؤو راور اؤ اؤناؤوؤ
 (دؤناؤؤ اؤؤؤؤ) اؤؤ اؤؤ اؤؤؤؤؤؤ اؤؤؤؤؤ.

12 سؤؤؤؤؤ 1431
 21 سؤؤؤؤؤ 2010

ؤؤؤؤؤؤؤ
 راور ناؤؤؤؤؤؤ، قؤؤؤؤؤؤؤ

سؤسؤؤؤ: GS53/2010/10

اؤؤؤؤؤ

دؤؤو ووسو ناؤوؤ اؤو راور اؤ اؤناؤوؤ
 ناؤؤؤؤؤؤ اؤؤ اؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ
 سؤسؤؤؤ GS53/2010/08 اؤؤؤؤؤؤ اؤؤؤؤؤ
 اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ
 اؤ اؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ

وؤؤ، سؤسؤؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ
 ناؤؤؤؤؤؤ اؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ
 قؤؤؤؤؤؤ 2010 سؤؤؤؤؤؤ 27 وؤ قؤؤؤؤ
 13:00 سؤ 14:00 اؤؤ قؤؤؤؤ دؤؤؤؤؤ
 6527782 قؤؤؤؤؤؤ دؤؤؤؤؤؤ دؤؤؤؤؤؤ
 2010 اؤؤؤؤؤؤ 04 وؤ قؤؤؤؤ 14:00 اؤؤ
 دؤؤؤؤؤؤ قؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ
 اؤؤؤؤؤؤ 14:00 اؤؤ 6527780 اؤؤ اؤؤؤؤؤؤؤ
 قؤؤؤؤؤؤ قؤؤؤؤؤؤؤ

23 سؤؤؤؤؤؤ 2010

- 50 اؤؤؤؤؤؤ (دؤؤؤؤؤؤ / راورؤؤ)
- 10 اؤؤؤؤؤؤ (اؤؤؤؤؤؤ وؤؤؤؤؤؤ)
- 10 اؤؤؤؤؤؤ (اؤؤؤؤؤؤؤ قؤؤؤؤؤ)

وؤؤ، دؤؤؤؤؤ دؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ
 قؤؤؤؤؤؤ 06 اؤؤؤؤؤ 2010 وؤ قؤؤؤؤؤ 12:00 اؤؤ
 دؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤ دؤؤؤؤؤؤ
 14 اؤؤؤؤؤؤ 2010 وؤ قؤؤؤؤؤ 12:00 اؤؤ
 دؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ اؤؤؤؤؤؤؤ
 اؤؤؤؤؤؤ.

12 سؤؤؤؤؤ 1431
 21 سؤؤؤؤؤ 2010

دؤؤؤؤؤؤ
 دؤؤاؤ اؤؤؤ اؤؤؤ

سؤسؤؤؤ: 144-A3/2010/448

اؤؤؤؤؤ

دؤؤؤؤؤ دؤؤؤؤؤؤ قؤؤؤؤؤؤؤ
 اؤؤؤؤؤؤؤ.

قؤسؤسؤؤ اؤؤؤؤؤؤ قؤؤؤؤؤؤؤ:

- 02 اؤؤؤؤؤؤؤ
- 10 وؤؤؤؤؤؤ (سؤؤؤؤؤ)

10. اس وقت کے لئے

11. اس وقت کے لئے

GS19-A /2010/27

دعا

اس وقت کے لئے

دعا کے لئے جس کا مقصد ہے کہ اس وقت کے لئے 13 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں سرکاری طور پر 23/2010/19-A GS اس وقت کے لئے ہے۔

اس وقت کے لئے 13 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں سرکاری طور پر 23/2010/19-A GS اس وقت کے لئے ہے۔

اس وقت کے لئے 13 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں سرکاری طور پر 23/2010/19-A GS اس وقت کے لئے ہے۔

• اس وقت کے لئے

27 سو فیصد سے کم ہو جائے اور 2010 (27) کی ڈیڑھ گھنٹے میں 10:00

• اس وقت کے لئے

30 سو فیصد سے کم ہو جائے اور 2010 (30) کی ڈیڑھ گھنٹے میں 10:00

اس وقت کے لئے 30 سو فیصد سے کم ہو جائے اور 2010 (30) کی ڈیڑھ گھنٹے میں 10:00

اس وقت کے لئے 30 سو فیصد سے کم ہو جائے اور 2010 (30) کی ڈیڑھ گھنٹے میں 10:00

10 سو فیصد سے کم ہو جائے اور 2010

19 سو فیصد سے کم ہو جائے اور 2010

دعا کے لئے

دعا کے لئے

A-2010/38

دعا

دعا کے لئے جس کا مقصد ہے کہ اس وقت کے لئے 02 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں

02 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں (HP LaserJet p1006)

01 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں (HP LaserJet 1020)

01 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں (Brother brand, MFC - 7340) TN-2130

دعا کے لئے جس کا مقصد ہے کہ اس وقت کے لئے 11 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں

11 سو فیصد سے کم ہو جائے اور 2010

20 سو فیصد سے کم ہو جائے اور 2010

دعا کے لئے

دعا کے لئے

GS56/2010/IUL/13

دعا

دعا کے لئے جس کا مقصد ہے کہ اس وقت کے لئے 01 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں

01 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں (01) 12/2010/IUL/56 GS اس وقت کے لئے ہے۔

اس وقت کے لئے 12 سو فیصد سے کم ہو جائے اور 2010 کی ڈیڑھ گھنٹے میں 6500048

23 سو فیصد سے کم ہو جائے اور 2010

ՆԱԴԻՐ ՆԱԴԻՐ

Երեւանի քաղաքապետարան

Մարտի 26-ի 2010 թվականի հունիսի 26-ի
Քաղաքապետարանի կողմից

Նիստի համար: 69-RA/IL/2010/04

ՆԱԴԻՐ

Նախագահության կողմից ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ
26 հունիսի 2010 (հունիսի) ժամը 11:00-ին ՆԱԴԻՐ ՆԱԴԻՐ
03 հունիսի 2010 (հունիսի) ժամը 11:00-ին ՆԱԴԻՐ ՆԱԴԻՐ
ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ
ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ
ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ
ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ

06 հունիսի 1431
15 հունիսի 2010

ՆԱԴԻՐ ՆԱԴԻՐ

Քաղաքապետարան
Քաղաքապետարան

Նիստի համար: (IUL)14-A3/1/2010/1034

ՆԱԴԻՐ

ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ
(IUL)14-A3/1/2010/1027 (05 հունիսի 2010) ՆԱԴԻՐ ՆԱԴԻՐ
ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ
ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ
ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ
ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ ՆԱԴԻՐ

13 հունիսի 1431
21 հունիսի 2010

זכרונות ועבודות:

- 1- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".
- 2- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".
- 3- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".
- 4- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".
- 5- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".
- 6- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".
- 7- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".
- 8- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".
- 9- אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".

ביום שבת 21 ספטמבר 2010 וספר תפילות 15:00 ו תפילות 15:00 ו תפילות 15:00

תפילות 15:00 ו תפילות 15:00 ו תפילות 15:00

תפילות 15:00 ו תפילות 15:00 ו תפילות 15:00

- תפילות 15:00 ו תפילות 15:00 ו תפילות 15:00
- תפילות 15:00 ו תפילות 15:00 ו תפילות 15:00
- תפילות 15:00 ו תפילות 15:00 ו תפילות 15:00

7 אגודת תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן" תלמידי תורה "בית אהרן".

05 ספטמבר 1431

14 ספטמבר 2010

يا بيمبري ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 ڏيئو ابراهيم ڏيئو ابراهيم

سٽوڻ نمبر: (IUL)160-A/1/2010/1019

اڻوڻ

ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم

ڏيئو:

ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 (3 ڏيئو)
 1

ڏيئو: 4465/-

ڏيئو: 1500/-

ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 ڏيئو ابراهيم ڏيئو ابراهيم

يا بيمبري ڏيئو ابراهيم ڏيئو ابراهيم

ڏيئو:

1- ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 2 ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم

2- ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم

3- ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم

4- ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم

5- ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 ڏيئو ابراهيم

6- ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم
 ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم ڏيئو ابراهيم

16 ސަបްތެމްބަރު 2010

ފަންނީ ބޭނުން

މަސައްދަވާ ގޮތުން ފަންނީ ބޭނުން 2 (ސަބްސަރުކާރުގެ ފަންނީ ބޭނުން 2)

4 ގަޑިއިރު (ފަންނީ ބޭނުން 4)

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް

02 ވަނަ ބައި

މި ފަންނީ ބޭނުން ގޮތުން ފަންނީ ބޭނުން / ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް ގޮތުން ފަންނީ ބޭނުން 2 (ސަބްސަރުކާރުގެ ފަންނީ ބޭނުން 2)

މި ފަންނީ ބޭނުން ގޮތުން ފަންނީ ބޭނުން 2

މި ފަންނީ ބޭނުން 7,875/- ރުފިޔާ

މި ފަންނީ ބޭނުން 3,500/- ރުފިޔާ

މި ފަންނީ ބޭނުން ގޮތުން ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2

މި ފަންނީ ބޭނުން ގޮތުން

މި ފަންނީ ބޭނުން ގޮތުން ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2

މި ފަންނީ ބޭނުން ގޮތުން

1. ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2 (ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2)
2. ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2 (ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2)
3. ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2 (ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2)

މި ފަންނީ ބޭނުން ގޮތުން

13 ސަបްތެމްބަރު 2010 ގަޑިއިރު ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2 ގެ ފަންނީ ބޭނުން 2



ފަންނީ ވަޒީފާ

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު 1 (ސަރުކާރުގެ ނަމުގައި ފަންނީ ވަޒީފާ)

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު 3 (ފަންނީ ވަޒީފާ ސަބަބުން)

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު

02 ސަބަބުން

ފަންނީ ވަޒީފާ ފުރުޞަތު ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު / ފަންނީ ވަޒީފާ ފުރުޞަތު ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު 3 ސަބަބުން 4 ސަބަބުން ފަންނީ ވަޒީފާ ސަބަބުން

ފަންނީ ވަޒީފާ ސަބަބުން ފަންނީ ވަޒީފާ ސަބަބުން

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު 7,035/-

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު 3,500/-

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު 4 ސަބަބުން ފަންނީ ވަޒީފާ ސަބަބުން

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު

- ސަރުކާރުގެ ނަމުގައި ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު
- ސަރުކާރުގެ ނަމުގައި ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު
- ސަރުކާރުގެ ނަމުގައި ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު

1 ސަބަބުން ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު (ސަރުކާރުގެ ނަމުގައި ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު)

ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު 3 ސަބަބުން 4 ސަބަބުން ފަންނީ ވަޒީފާ ސަބަބުން

2. ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު 4 ސަބަބުން 4 ސަބަބުން ފަންނީ ވަޒީފާ ސަބަބުން

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު

3. ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު 4 ސަބަބުން 4 ސަބަބުން ފަންނީ ވަޒީފާ ސަބަބުން

ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު

13 ވަނަ އަދަދުގެ ސަރުކާރުގެ ގެޒެޓް 2010 ވަނަ އަދަދުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ފަންނީ ވަޒީފާ ހޯދާ ފަރާތްތަކުގެ ނަންބަރު

މަސައްކަތްކުރާ ފަރާތްތަކުގެ ނަންބަރު



د ډیجیټل کورسونه پرمختګ
د ژوند لپاره لارښوونه.

سېرسره نوم: 198-A/2010/57		د ډیجیټل کورسونه	
نېټه: 19 د کورنیو د شخړو د 2010			
نوم: اې. اې. اې. 1	د ډیجیټل کورسونه		د ډیجیټل کورسونه
		20 (کورس لاندې کورسونه)	
15. م. واکونه لاندې،	8. م. واکونه لاندې،	1. م. واکونه لاندې،	د ډیجیټل کورسونه
16. واکونه لاندې،	9. م. واکونه لاندې،	2. م. واکونه لاندې،	
17. واکونه لاندې،	10. م. واکونه لاندې،	3. م. واکونه لاندې،	
18. واکونه لاندې،	11. واکونه لاندې،	4. م. واکونه لاندې،	
19. واکونه لاندې،	12. واکونه لاندې،	5. م. واکونه لاندې،	
20. واکونه لاندې،	13. واکونه لاندې،	6. م. واکونه لاندې،	
	14. واکونه لاندې،	7. م. واکونه لاندې،	
	8835/- کورسونه (کورسونه د کورسونه)		د کورسونه
		کورسونه لاندې -2000 (کورسونه) د کورسونه د کورسونه د کورسونه،	د کورسونه د کورسونه
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه.	
		1- د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	د کورسونه
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		2- د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه.	
		1- د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	د کورسونه
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه.	
		3- د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		4- د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		5- د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه،	
		د کورسونه د کورسونه د کورسونه د کورسونه د کورسونه.	

- انصاف و عدالت کے لیے، حکومت نے ایک نیا قانون منظور کیا ہے، جس کے تحت اگر کوئی شخص کسی اور کو ہراساں کرے، تو اس کے خلاف کارروائی کی جائے گی۔

2۔ حکومت نے ایک نیا قانون منظور کیا ہے، جس کے تحت اگر کوئی شخص کسی اور کو ہراساں کرے، تو اس کے خلاف کارروائی کی جائے گی۔

● حکومت نے ایک نیا قانون منظور کیا ہے، جس کے تحت اگر کوئی شخص کسی اور کو ہراساں کرے، تو اس کے خلاف کارروائی کی جائے گی۔

دستور:	سولہویں ترمیم، 1980ء کے تحت
ممبروں کی تعداد:	1
موضوع اور اہمیت:	1980ء کے تحت / 1980ء کے تحت
دستور:	14,700/-
دستور:	1980ء کے تحت / 1980ء کے تحت

دستور:

- 1980ء کے تحت / 1980ء کے تحت

- 1980ء کے تحت / 1980ء کے تحت

- 1980ء کے تحت / 1980ء کے تحت

- 1980ء کے تحت / 1980ء کے تحت

- 1980ء کے تحت / 1980ء کے تحت

دستور:	سولہویں ترمیم، 1980ء کے تحت
ممبروں کی تعداد:	1
موضوع اور اہمیت:	1980ء کے تحت / 1980ء کے تحت
دستور:	14,700/- / 11,900/-
دستور:	1980ء کے تحت / 1980ء کے تحت

- ٻٻڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري، ڪو به ڪم ڪري سگهڻ لاءِ اکر
لڳائي ڏيڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.

ٻٻڻ:

ٻٻڻ لاءِ

- ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ 2 لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ 2 لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.

ٻٻڻ

- ٻٻڻ 2 لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ 2 لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.

ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.	ٻٻڻ:
1	ٻٻڻ لاءِ
ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.	ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
11,900/-	ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.	ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.	ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.
- ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.	ٻٻڻ لاءِ سڃاڻپ ڪري، ان جي ٻڙڻ ۽ ٻڙڻ لاءِ سڃاڻپ ڪري.

<p>1. 2019-2020 10,500/-</p>	<p>1. 2019-2020 10,500/-</p>
<p>2. 2020-2021 10,500/-</p>	<p>2. 2020-2021 10,500/-</p>
<p>3. 2021-2022 10,500/-</p>	<p>3. 2021-2022 10,500/-</p>
<p>4. 2022-2023 10,500/-</p>	<p>4. 2022-2023 10,500/-</p>
<p>5. 2023-2024 10,500/-</p>	<p>5. 2023-2024 10,500/-</p>
<p>6. 2024-2025 10,500/-</p>	<p>6. 2024-2025 10,500/-</p>
<p>7. 2025-2026 10,500/-</p>	<p>7. 2025-2026 10,500/-</p>
<p>8. 2026-2027 10,500/-</p>	<p>8. 2026-2027 10,500/-</p>
<p>9. 2027-2028 10,500/-</p>	<p>9. 2027-2028 10,500/-</p>
<p>10. 2028-2029 10,500/-</p>	<p>10. 2028-2029 10,500/-</p>
<p>11. 2029-2030 10,500/-</p>	<p>11. 2029-2030 10,500/-</p>
<p>12. 2030-2031 10,500/-</p>	<p>12. 2030-2031 10,500/-</p>
<p>13. 2031-2032 10,500/-</p>	<p>13. 2031-2032 10,500/-</p>
<p>14. 2032-2033 10,500/-</p>	<p>14. 2032-2033 10,500/-</p>
<p>15. 2033-2034 10,500/-</p>	<p>15. 2033-2034 10,500/-</p>
<p>16. 2034-2035 10,500/-</p>	<p>16. 2034-2035 10,500/-</p>
<p>17. 2035-2036 10,500/-</p>	<p>17. 2035-2036 10,500/-</p>
<p>18. 2036-2037 10,500/-</p>	<p>18. 2036-2037 10,500/-</p>
<p>19. 2037-2038 10,500/-</p>	<p>19. 2037-2038 10,500/-</p>
<p>20. 2038-2039 10,500/-</p>	<p>20. 2038-2039 10,500/-</p>
<p>21. 2039-2040 10,500/-</p>	<p>21. 2039-2040 10,500/-</p>
<p>22. 2040-2041 10,500/-</p>	<p>22. 2040-2041 10,500/-</p>
<p>23. 2041-2042 10,500/-</p>	<p>23. 2041-2042 10,500/-</p>
<p>24. 2042-2043 10,500/-</p>	<p>24. 2042-2043 10,500/-</p>
<p>25. 2043-2044 10,500/-</p>	<p>25. 2043-2044 10,500/-</p>
<p>26. 2044-2045 10,500/-</p>	<p>26. 2044-2045 10,500/-</p>
<p>27. 2045-2046 10,500/-</p>	<p>27. 2045-2046 10,500/-</p>
<p>28. 2046-2047 10,500/-</p>	<p>28. 2046-2047 10,500/-</p>

<p>4</p>	<p>4</p>
<p>9,100/-</p>	<p>9,100/-</p>
<p>2</p>	<p>2</p>

1. 2010 15:30
2. 2010 15:30
3. 2010 15:30
4. 2010 15:30
5. 2010 15:30

www.mira.gov.mv

3316577

3322261

info@mira.gov.mv

ENERGETIC, CAREER-ORIENTED, RESPONSIBLE PERSONNEL, APPLY
FOR ONE OF THE MOST CHALLENGING JOBS IN THE COUNTRY

AIR TRAFFIC CONTROL



Reference no: 116-IL-A31/2010/43

21st September 2010

Apply for: **AIR TRAFFIC CONTROL OFFICER (TRAINEE)**

Number of vacancies: 02

Age: Between 20 -25 yrs

Place of work: Male' International Airport, Hanimaadhoo Airport, Kahdhoo Airport, Kaadedhoo Airport and Gan Airport.

Qualifications:

- GCE 'O' Level English and Maths - Grade 'B' or higher.
- SSC Dhivehi - Grade 'C' or higher.

Preference will be given to applicants:

- With 'C' or higher pass in any two science subjects in GCE 'O' Level.
- With 'C' or higher pass in English and Maths in GCE 'A' Level.
- Computer literate.

Final selection will be carried out after the candidates have undergone Class 3 Aviation Medical

Diploma and Degree holders are encouraged to apply.

Remuneration:

An attractive salary package including daily food allowance, group medical insurance and rating allowance will be given.

Gross Salary Approximately : MRF 11,500.00

Selected candidates shall acquire minimum Level 4 in ICAO English Language Proficiency Exam.

Training will be provided in-house and abroad.

Send applications to: CEO & Managing Director, Maldives Airports Company Ltd, Male' International Airport, Hulhule, through e-mail or by fax. E-mail- employment@maclnet.net, Fax : 3331515.

Deadline for submission: 30th September 2010

For more information logon to <http://www.airports.com.mv>

For inquiries contact: : 3337243 / 7981879

1 18,900/- 18,900/-	1 18,900/- 18,900/-
1 18,900/- 18,900/-	1 18,900/- 18,900/-
1 18,900/- 18,900/-	1 18,900/- 18,900/-
1 18,900/- 18,900/-	1 18,900/- 18,900/-

سۆزۈمۈز ئۈچۈن بۇ ھۆكۈم
دۆڭ، تېررور ئىش.

سۈرۈش نۇمۇرى: CUL/2010/0019

بۇ ئىش

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم
بۇ ئىش.

1. دۆڭ: 1- ئىش ئۈچۈن

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم. د. دۆڭ

ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

2 دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم. د. دۆڭ

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم. د. دۆڭ

تۈزۈلۈش ئۈچۈن بۇ ھۆكۈم.

دۆڭ ئىش: دۆڭ -/3470 ئىش

بۇ ئىش: -/1000 ئىش

2. دۆڭ: 1- ئىش ئۈچۈن

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم. د. دۆڭ

ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

2 دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم. د. دۆڭ

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم. د. دۆڭ

تۈزۈلۈش ئۈچۈن بۇ ھۆكۈم.

دۆڭ ئىش: دۆڭ -/3470 ئىش

بۇ ئىش: -/1000 ئىش

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

02 ئىش ئۈچۈن بۇ ھۆكۈم.

3. دۆڭ: 1- ئىش ئۈچۈن

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم. د. دۆڭ

ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم. د. دۆڭ

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم.

دۆڭ ئىش: دۆڭ -/4465 ئىش

بۇ ئىش: -/1000 ئىش

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

تۈزۈلۈش: 3009910

تۈزۈلۈش: 3315307

11 ئىش ئۈچۈن 1431

20 ئىش ئۈچۈن 2010

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

دۆڭ، تېررور ئىش.

سۈرۈش نۇمۇرى: (IUL) 10-H/1/2010/1072

بۇ ئىش

دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: (IUL)10-C/1/2010/1063

(29 ئىش 2010) بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم

29 ئىش 2010 دۆڭ ئىش ئۈچۈن بۇ ھۆكۈم

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

بۇ ئىش ئۈچۈن بۇ ھۆكۈم: بۇ ئىش ئۈچۈن

06 ئىش ئۈچۈن 1431

15 ئىش ئۈچۈن 2010

Male' Health Services Corporation Ltd.
Kanbaa Aisarani Higun, Male'20402
Republic of Maldives
Reg. No.: C-0276/2010

Ref. No: MHSC-IULAAN/P/2010/21

Male' Health Service Corporation (MHSC) Ltd is seeking capable, enthusiastic candidates for the following post.

Post: Quality assurance and International standards consultant

Location: Indira Gandhi Memorial Hospital (IGMH)
Male' Health Services Corporation (MHSC) Ltd
Male', Republic of Maldives

Period of Assignment: 1 Year

Type of employment: full time

Working Hours: 40 hours per week

Main responsibilities of the job

- Develops, and implements Quality assurance standards, policies and procedures in the hospital setting to ensure quality care to patients.
- Sets QA compliance objectives and ensures that targets are achieved.
- Periodically reviews existing quality assurance standards, hospital policies and procedures to evaluate effectiveness of quality assurance program.
- Monitors and advices on the performances of the quality management system and report performance, measuring against set indicators.
- Identifies relevant national and international quality standards and best practice to ensure compliance with them.
- Liaises with department heads and staff throughout the organization to ensure that the QA system is functioning properly.
- Where appropriate, advices on changes and their implementation in the QA system and provides training, tools and techniques to enable others to achieve quality.
- Works with purchasing staff to establish quality requirements from external suppliers.
- Identifies and coordinates relevant quality related trainings in liaison with training division.
- Directs, monitors and evaluates safe practices and

- procedures
- Coordinates or develops standard operating procedures
- Develops competency standards, and documentation requirements.
- Coordinates or performs quality assurance system audits
- Be informed of the changes in the international quality standards, policies and protocols and revise the hospital QA system accordingly.
- Coordinates and implement measures to obtain membership and accreditation with international quality related organizations.

Qualification

- The candidate should have a Master's degree in a relevant field and 3 years experience in the field.
- OR**
- A Bachelor's degree in health related field and 7 years relevant work experience.
 - Knowledge and understanding of International standards for quality assurance and control of hospitals would be an advantage.

Benefits

Salary is negotiable, based on experience and qualification of the applicant

The application should include:

- Application letter
- Attested academic certificates
- CV
- ID card copy / passport Copy

Applications should be forwarded to:

**Male' Health Services Corporation (MHSC) Ltd,
Indira Gandhi Memorial Hospital (IGMH)
Male', Republic of Maldives
Email: traning.mhsc.maldives@gmail.com.mv**

Application deadline: 1400hrs of 26 September 2010

For Further information please call 3335363

සේවයේ සේවයක් කිරීමට
දැනුවත් කර ඇත.

සේවයේ: CUL/2010/0020

අවදානම

දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට
දැනුවත් කර ඇත.

1. දැනුවත්: 1- දැනුවත් කිරීමේ සේවය

සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.

දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
2. දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.

දැනුවත්: 3470/- රුපියල් මිලියන

දැනුවත්: 1000/- රුපියල් මිලියන

2. දැනුවත්: 1- දැනුවත් කිරීමේ සේවය

සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.

දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
2. දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.

දැනුවත්: 3470/- රුපියල් මිලියන

දැනුවත්: 1000/- රුපියල් මිලියන

සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
02 රුපියල් මිලියන සේවයේ සේවයක් කිරීමට.

3. දැනුවත්: 1- දැනුවත් කිරීමේ සේවය

සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.

දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
02 රුපියල් මිලියන සේවයේ සේවයක් කිරීමට.

දැනුවත්: 4465/- රුපියල් මිලියන

දැනුවත්: 1000/- රුපියල් මිලියන

දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.

දැනුවත් කර ඇත. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
26 ඔක්තෝබර් 2010 දින 14:00 දී සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.
සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට. සේවයේ සේවයක් කිරීමට.

දුරකථන: 3009910

දුරකථන: 3315307

11 ඔක්තෝබර් 1431

20 ඔක්තෝබර් 2010

Duration:

The consultants will be hired for a defined period for each Instructional Materials Development assignment. The length of each contract will be 3 months.

Interested personnel may obtain the detailed National Occupational Standards and Terms of Reference (ToR) from the address given below or from our website <http://www.tvet.gov.mv>.

Individuals or companies who are interested can submit their proposals including cost details and CV's, along with the covering letter by **1500 hours** (local time) **29th September, 2010** to the following address.

Technical and Vocational Education and Training (TVET),
Ministry of Human Resources, Youth and Sports
Haveeree Higu, Maafannu, Male' 20210
Tel: + (960) 3347342, + (960) 3347339 Fax: + (960) 3347493
Email: info@tvet.gov.mv; hanna@employment.gov.mv

Ministry of Human Resources, Youth and Sports

Male', Republic of Maldives

Ref No: 141-TVET/1/2010/1033

Date: 08th September, 2010

REQUEST FOR APPLICATION FOR STANDARD WRITERS, INSTRUTIONAL MATERIALS DEVELOPERS AND ASSESSMENT RESOURCE BOOKS DEVELOPERS

Subject: Instructional Materials Development and Assessment of Resource Books under Integrated Human Development Project (IHDP).

Ministry has decided to cancel the announcement (Ref No: 141-TVET/1/2010/1016) made on 07th July, 2010 as only one party applied for the development of Instructional Materials and Assessment Resource Books.

Hence, under the Employment Component of Integrated Human Development Project (IHDP) funded by the World Bank, the Ministry of Human Resources, Youth and Sports (MHRYS) again invites qualified and interested candidates to apply for the development of Instructional Materials and Assessment Resource Books for the below indentified National Occupational Standards.

#	Occupational Standard	Level
1	IT Technician	Level II
2	Retail Service	Level II
3	F& B Service Personnel	Level II
4	Tour Guide	Level II
5	Front Office	Level II
6	Food Preparation	Level II
7	Welding	Level III
8	Automotive Mechanic	Level II
9	Marine Mechanic	Level II
10	Refrigeration and Air Conditioning	Level II

Qualification:

- To develop Instructional Materials, it is important to combine the skills of trained Instructional Materials Developers with the specific job skills of specialists identified by the ESCs and others as practicing masters of the jobs for which standards are being set.
- Should understand the specific job requirements of the occupation for which the standards are set.
- These positions maybe of interest to Technical Educators, Sector specialists, Training Consultants and private or public sector technical managers.
- A bachelors degree in education, human resource management or a an equivalent qualification related to the position and the activities of the sector
- Knowledge of the employment structure and working conditions of the sector
- Experience in strategic planning for training or staff development activities would be an added advantage.

دوره وسمه پژوهش‌ها
 در زمینه حقوق اساسی
 دکترا، حقوق اساسی

شماره ثبت: (IUL)213-MC/1/2010/1016

موضوع

موضوع: بررسی حقوق اساسی در 30 شهریورماه 2010 و نیز راجع به...

موضوع	روز	زمان	مدرس
• بررسی راجع به...	سه شنبه	3 روزه (تقریباً)	دکتر...
• بررسی راجع به...	سه شنبه		دکتر...

این دوره در روزهای سه شنبه و چهارشنبه و پنجشنبه در سالن اجتماعات هیئت مدیره دانشگاه تهران برگزار خواهد شد. در روزهای سه شنبه و چهارشنبه در ساعت 16:00 و در روز پنجشنبه در ساعت 9:00 برگزار خواهد شد. در صورت نیاز به تغییرات در برنامه، اطلاعیه جداگانه صادر خواهد شد.

روزها: در روزهای سه شنبه و چهارشنبه و پنجشنبه در ساعت 16:00 و در روز پنجشنبه در ساعت 9:00 برگزار خواهد شد. در صورت نیاز به تغییرات در برنامه، اطلاعیه جداگانه صادر خواهد شد.

28 مردادماه 1431

07 شهریورماه 2010

دوره وسمه حقوق اساسی
 دکترا، حقوق اساسی

شماره ثبت: (IUL)142-A4/1/2010/1038

موضوع

موضوع: بررسی حقوق اساسی در 25 شهریورماه 2010

این دوره در روزهای سه شنبه و چهارشنبه و پنجشنبه در سالن اجتماعات هیئت مدیره دانشگاه تهران برگزار خواهد شد. در روزهای سه شنبه و چهارشنبه در ساعت 16:00 و در روز پنجشنبه در ساعت 9:00 برگزار خواهد شد. در صورت نیاز به تغییرات در برنامه، اطلاعیه جداگانه صادر خواهد شد.

روزها: در روزهای سه شنبه و چهارشنبه و پنجشنبه در ساعت 16:00 و در روز پنجشنبه در ساعت 9:00 برگزار خواهد شد.

25 شهریورماه 2010

مدرس: دکتر...

04 شهریورماه 2010

Երևանի քաղաքապետարանի քաղաքապետի կողմից
Վճարված է:

Թվանշան: (IUL)142-A4/1/2010/1040

Վճար

Երևանի քաղաքապետարանի կողմից 2010

Երևանի քաղաքապետարանի կողմից 2010 թվականի 03 հունիսին իրականացված աշխատանքների մասին հաշվետվությունը կատարվել է 2010 թվականի 03 հունիսին, ժամը 16:00-ին և 2010 թվականի 28 հունիսին կատարված աշխատանքների մասին հաշվետվությունը կատարվել է 2010 թվականի 30 հունիսին, ժամը 14:30-ին:

11 հաշվետվություն 1431

20 հունիսին 2010

Վճար

Երևանի քաղաքապետարանի քաղաքապետի կողմից
Վճարված է:

Թվանշան: (IUL)138/1/2010/

Վճար

Երևանի քաղաքապետարանի կողմից 2010 թվականի 08 հունիսին իրականացված աշխատանքների մասին հաշվետվությունը կատարվել է 2010 թվականի 16 հունիսին, ժամը 16:00-ին և 2010 թվականի 25 հունիսին կատարված աշխատանքների մասին հաշվետվությունը կատարվել է 2010 թվականի 08 հունիսին, ժամը 16:00-ին և 2010 թվականի 25 հունիսին կատարված աշխատանքների մասին հաշվետվությունը կատարվել է 2010 թվականի 08 հունիսին, ժամը 16:00-ին:

22 հունիսին 2010

سرویس سرویس	مقدار	موصوفه	سرویس سرویس	سرویس سرویس
دیسکونٹ 100.00 سے زائد.				
5,000.00	40,632.96	پیسٹ رے فائبر ایچ جی پی ایس ایس ایس ایس ایس	94	4780
55,000.00	212,621.72	لاچر ڈھونڈی پینل Size: 300 x 300 cm (430 ctns = 11 sheets)	430	4520
	3,141.42	گروٹس ڈھونڈی پینل Size: 23.5" x 12" x 01" (278 pcs)	03	
2,500.00	10,061.55	گروٹس ڈھونڈی پینل 1100 x 450 x 1100 رولز 50 پیس	01	4778
450.00	1,889.00	Nyatoth Moulding T&G Ceiling 0.5635 - 12 پیس، 93 ڈیڑی ڈی 220 ڈی ڈی	01	4779-4
450.00	1,889.00	Nyatoth Moulding T&G Ceiling 0.7123 - 12 پیس، 92 ڈیڑی ڈی 300 ڈی ڈی	01	4779-6
450.00	1,889.00	Nyatoth Moulding - 0.9878 20 ڈیڑی ڈی، 80 ڈیڑی ڈی 276 ڈی ڈی	01	4779-9
450.00	1,889.00	Nyatoth Moulding - 0.4627 20 ڈیڑی ڈی، 80 ڈیڑی ڈی 224 ڈی ڈی	01	4779-11
40,000.00	132,817.60	گروٹس ڈھونڈی پینل Style: T-2000, Thickness: Nominal 2mm, Length: 50 mt (164.05 ft), Width: 100 cm (39.37 inches), sq mt (ft) / roll: 50 sq mt (538 sqft)	85	4970
5,513.00	11,025.00	گروٹس ڈھونڈی پینل (77 پیس) 2 3/4" x 3 3/4" x 17' x 18 pcs (0.0438 TON) 2 3/4" x 3 3/4" x 18' x 59 pcs (1.5211 TON)	01	4897
7,774.00	15,548.00	گروٹس ڈھونڈی پینل (77 پیس) 2 3/4" x 3 3/4" x 19' x 06 pcs (0.1633 TON) 2 3/4" x 3 3/4" x 20' x 71 pcs (2.0339 TON)	01	4898
11,238.00	22,475.00	گروٹس ڈھونڈی پینل (77 پیس) 4' x 2 3/4" x 19' x 15 pcs (0.5938 TON) 4" x 3 3/4" x 20' x 62 pcs (2.0339 TON)	01	4899
7,951.00	15,902.00	گروٹس ڈھونڈی پینل (77 پیس) 2 3/4" x 3 7/8" x 19' x 18 pcs (0.5062 TON) 2 3/4" x 3 7/8" x 20' x 59 pcs (1.7464 TON)	01	4900
5,362.00	10,724.00	گروٹس ڈھونڈی پینل (102 پیس) 4 1/2" x 1 5/8" x 14' x 58 pcs (0.8247 TON) 4 1/2" x 1 5/8" x 16' x 34 pcs (0.5525 TON) 4 3/4" x 1 5/8" x 15' x 10 pcs (0.1523 TON)	01	4901

5,972.00	11,944.00	صنعة حديدية (102) 4 3/4" x 1 3/4" x 14' x 70 pcs (1.1314 TON) 4 3/4" x 1 3/4" x 15' x 32 pcs (0.5542 TON)	01	4902
5,937.00	11,873.00	صنعة حديدية (119) 1 3/4" x 3 3/4" x 15' x 51 pcs (0.6973 TON) 1 3/4" x 3 3/4" x 16' x 68 pcs (0.9917 TON)	01	4903
5,902.00	11,803.00	صنعة حديدية (102) 4 1/2" x 1 3/4" x 14' x 30 pcs (0.4594 TON) 4 1/2" x 1 3/4" x 15' x 48 pcs (0.7875 TON) 4 1/2" x 1 3/4" x 16' x 24 pcs (0.4200 TON)	01	4904
5,902.00	11,803.00	صنعة حديدية (119) 3 3/4" x 1 3/4" x 13' x 23 pcs (0.2725 TON) 3 3/4" x 1 3/4" x 14' x 96 pcs (1.2250 TON)	01	4905
5,301.00	10,602.00	صنعة حديدية (119) 3 3/4" x 1 3/4" x 13' x 18 pcs (0.2133 TON) 3 3/4" x 1 3/4" x 14' x 101 pcs (1.2888 TON)	01	4906
15,120.00	30,241.00	صنعة حديدية (CANTER) في سوبرماركت	11	4976
12,442.00	24,884.00	صنعة حديدية (IST) في سوبرماركت	14	4990
15,871.00	31,742.00	صنعة حديدية (TERIAS KID) في سوبرماركت	27	4982
15,896.00	31,792.00	صنعة حديدية (SCRUM) في سوبرماركت	27	4980
14,923.00	29,846.00	صنعة حديدية (ISUZU) في سوبرماركت	10	4985
12,150.00	24,299.00	صنعة حديدية 307 في سوبرماركت	13	4977
15,896.00	31,792.00	صنعة حديدية (MARCH) في سوبرماركت	27	4987
15,901.00	31,802.00	صنعة حديدية (MARCH) في سوبرماركت	27	4988
15,896.00	31,792.00	صنعة حديدية (DAIWOO) في سوبرماركت	27	4983
15,734.00	31,467.00	صنعة حديدية BMW في سوبرماركت	27	4975
14,920.00	29,841.00	صنعة حديدية (ELF) 150 في سوبرماركت	10	4989

صنعة حديدية 1280 / 4780 في سوبرماركت DVRU 143 1340

PLT NO	SIZE	QTY	Customs Duty	Auction Price
4780- 121	600 X 600 X 18 MM	50 PCS	2,000.00	1,000.00
4780 – 122	600 X 600 X 18 MM	55 PCS	2,200.00	1,100.00
4780 – 123	600 X 600 X 18 MM	55 PCS	2,200.00	1,100.00
4780 – 124	600 X 600 X 18 MM	50 PCS	2,000.00	1,000.00
4780 – 125	600 X 600 X 18 MM	55 PCS	2,200.00	1,100.00
4780 – 126	600 X 600 X 18 MM	55 PCS	2,200.00	1,100.00
4780 – 127	600 X 600 X 18 MM	50 PCS	2,000.00	1,000.00
4780 – 128	600 X 600 X 18 MM	55 PCS	2,200.00	1,100.00
4780 – 129	600 X 600 X 18 MM	55 PCS	2,200.00	1,100.00
4780 – 130	600 X 600 X 18 MM	50 PCS	2,000.00	1,000.00
4780 – 131	600 X 600 X 18 MM	55 PCS	2,200.00	1,100.00

30	TW-01 (1)	990 x 2400	Timber Frame sliding door	1 BED ROOM		
31	TW-01 (1)	990 x 2400	Timber Frame sliding door			
32	TW-01 (1)	990 x 2400	Timber Frame sliding door			
33	TW-01 (1)	990 x 2400	Timber Frame sliding door			
34	TW-01 (1)	990 x 2400	Timber Frame sliding door			
35	TW-01 (1)	990 x 2400	Timber Frame sliding door			
36	TW-01 (1)	990 x 2400	Timber Frame sliding door			
37	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM	12	PCS
38	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
39	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
40	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
41	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
42	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
43	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
44	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
45	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
46	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
47	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
48	GD-01 (1)	770 x 2360	Glass swing door with timber frame	1 BED ROOM		
49	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM	12	PCS
50	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
51	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
52	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
53	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
54	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
55	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
56	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
57	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
58	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
59	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
60	J-GD01 (1)	850 x 2400	Timber Jamb for GD-01 (1)	1 BED ROOM		
61	TD-03 (1)	2255 x 2400	Timber veneer sliding pocket door	1 BED ROOM	3	SET
62	TD-03 (1)	2255 x 2400	Timber veneer sliding pocket door	1 BED ROOM		
63	TD-03 (1)	2255 x 2400	Timber veneer sliding pocket door	1 BED ROOM		
64	TD-03 (1)	2255 x 2400	Timber veneer sliding pocket door	1 BED ROOM		
65	TD-03 (1)	2255 x 2400	Timber veneer sliding pocket door	1 BED ROOM		
66	TD-03 (1)	2255 x 2400	Timber veneer sliding pocket door	1 BED ROOM		
67	TW-02-A(1)	2000 x 1920	Frameless fixed glass panel 10mm thk	1 BED ROOM	3	SET
68	TW-02-A(1)	2000 x 1920	Frameless fixed glass panel 10mm thk	1 BED ROOM		
69	TW-02-A(1)	2000 x 1920	Frameless fixed glass panel 10mm thk	1 BED ROOM		
70	TW-02-B(1)	550 x 1920	Frameless fixed glass panel 8mm thk	1 BED ROOM		
71	TW-02-B(1)	550 x 1920	Frameless fixed glass panel 8mm thk	1 BED ROOM		
72	TW-02-B(1)	550 x 1920	Frameless fixed glass panel 8mm thk	1 BED ROOM		
73	TW-02-B(1)	550 x 1920	Frameless fixed glass panel 8mm thk	1 BED ROOM		
74	TW-02-B(1)	550 x 1920	Frameless fixed glass panel 8mm thk	1 BED ROOM		
75	TW-02-B(1)	550 x 1920	Frameless fixed glass panel 8mm thk	1 BED ROOM		
76	TW-01 (2)	1390 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM	2	SET
77	TW-01 (2)	1390 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
78	TW-01 (2)	1390 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
79	TW-01 (2)	1390 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		

80	TW-01 (2)	1390 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
81	TW-01 (2)	1390 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
82	TW-01 (2)	1390 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
83	TW-01 (2)	1390 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
84	TW-02 (2)	1110 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM	2	SET
85	TW-02 (2)	1110 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
86	TW-02 (2)	1110 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
87	TW-02 (2)	1110 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
88	TW-02 (2)	1110 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
89	TW-02 (2)	1110 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
90	TW-02 (2)	1110 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
91	TW-02 (2)	1110 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
92	TW-03 (2)	765 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM	2	SET
93	TW-03 (2)	765 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
94	TW-03 (2)	765 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
95	TW-03 (2)	765 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
96	TW-03 (2)	765 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
97	TW-03 (2)	765 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
98	TW-03 (2)	765 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
99	TW-03 (2)	765 x 2400	Timber frame sliding glass door	2 BED ROOM		
100	TD-01 (2)	1120 x 2360	Solid timber door	2 BED ROOM	2	PCS
101	TD-01 (2)	1120 x 2360	Solid timber door	2 BED ROOM		
102	J-TD01 (2)	1200 x 2400	Solid timber door	2 BED ROOM	2	PCS
103	J-TD01 (2)	1200 x 2400	Solid timber door	2 BED ROOM		
104	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM	10	PCS
105	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
106	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
107	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
108	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
109	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
110	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
111	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
112	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
113	TD-02 (2)	820 x 2360	Door Panel	2 BED ROOM		
114	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM	10	PCS
115	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
116	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
117	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
118	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
119	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
120	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
121	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
122	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
123	J-TD02 (2)	900 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
124	GD-01 (2)	770 x 2360	Glass swing door with timber frame	2 BED ROOM	4	PCS
125	GD-01 (2)	770 x 2360	Glass swing door with timber frame	2 BED ROOM		
126	GD-01 (2)	770 x 2360	Glass swing door with timber frame	2 BED ROOM		
127	GD-01 (2)	770 x 2360	Glass swing door with timber frame	2 BED ROOM		
128	J-GD01 (2)	850 x 2400	Timber Jamb for TD-01 (2)	2 BED ROOM	4	PCS
129	J-GD01 (2)	850 x 2400	Timber Jamb for TD-01 (2)	2 BED ROOM		

130	J-GD01 (2)	850 x 2400	Timber Jamb for TD-01 (2)	2 BED ROOM		
131	J-GD01 (2)	850 x 2400	Timber Jamb for TD-01 (2)	2 BED ROOM		
132	GD-02 (2)	920 x 2360	Glass swing door with timber frame	2 BED ROOM	4	PCS
133	GD-02 (2)	920 x 2360	Glass swing door with timber frame	2 BED ROOM		
134	GD-02 (2)	920 x 2360	Glass swing door with timber frame	2 BED ROOM		
135	GD-02 (2)	920 x 2360	Glass swing door with timber frame	2 BED ROOM		
136	J-GD02 (2)	1000 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM	4	PCS
137	J-GD02 (2)	1000 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
138	J-GD02 (2)	1000 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
139	J-GD02 (2)	1000 x 2400	Timber Jamb for TD-02 (2)	2 BED ROOM		
140	TW-04-A(2)	2400 x 1920	Frameless fixed glass panel 10mm thk	2 BED ROOM	2	SET
141	TW-04-A(2)	2400 x 1920	Frameless fixed glass panel 10mm thk	2 BED ROOM		
142	TW-04-B(2)	960 x1920	Frameless fixed glass panel 10mm thk	2 BED ROOM		
143	TW-04-B(2)	960 x1920	Frameless fixed glass panel 10mm thk	2 BED ROOM		
144	TW-04-B(2)	960 x1920	Frameless fixed glass panel 10mm thk	2 BED ROOM		
145	TW-04-B(2)	960 x1920	Frameless fixed glass panel 10mm thk	2 BED ROOM		
146	TW-05 (2)	2395 x 295	Frameless fixed glass panel 8mm thk	2 BED ROOM	2	PCS
147	TW-05 (2)	2395 x 295	Frameless fixed glass panel 8mm thk	2 BED ROOM		
148	TW-06a(2)	1220 x 2420	Frameless fixed glass panel 10mm thk	2 BED ROOM	2	PCS
149	TW-06a(2)	1220 x 2420	Frameless fixed glass panel 10mm thk	2 BED ROOM		
150	TW-06b-A(2)	455 x 2440	Frameless fixed glass panel 8mm thk	2 BED ROOM	2	SET
151	TW-06b-A(2)	455 x 2440	Frameless fixed glass panel 8mm thk	2 BED ROOM		
152	TW-06b-B(2)	750 x 2440	Frameless fixed glass panel 8mm thk	2 BED ROOM		
153	TW-06b-B(2)	750 x 2440	Frameless fixed glass panel 8mm thk	2 BED ROOM		
154			Set Hardware of Door & Window Part of set Hardware of D&W :		1	SET
		600 / 3 m	Rel top	4 PCS		
		94 x / 3 m	Rel under	12 PCS		
		94 x / 4 m	Rel under	17 PCS		
		301 / 4 m	Rel top	2 PCS		
		57 A/S	Wheel top / hanger	2 PCS		
		106N / 94	Wheel under / guide	72 PCS		
		601 p	Clipstop	4 PCS		
		100	Husky Pack	26 PCS		
		HH3 / 190	Stopper	4 PCS		
		HH3 / 301	Stopper	12 PCS		
		1B	Bracket	20 PCS		
		4"x3"X3MM2201	Hinges Glacia	56 PCS		
		SES0013	Door stop	16 PCS		

**AUCTION NO: 4976 / MITSUBISHI (CANTER) /
CHASSIS NO: FE82EEV-501827 / MANUFACTURED YEAR: 2003**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX
	:Model no
1	CABIN WITH STANDED ACCESSORIES
2	RADIATOR & CONDENSOR
1	REAR DECK
2	(FRONT WHEELS WITH SUSPENSION (L & R
2	(REAR WHEELS WITH SUSPENSION (L & R

1	FUEL TANK
1	FRONT BUMPER WITH TWO FOG LIGHTS
11	TOTAL PIECES

**AUCTION NO: 4976 / MITSUBISHI (CANTER) /
CHASSIS NO: FE82EEV-501827 / MANUFACTURED YEAR: 2003**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX :Model no
1	CABIN WITH STANDED ACCESSORIES
2	RADIATOR & CONDENSOR
1	REAR DECK
2	(FRONT WHEELS WITH SUSPENSION (L & R
2	(REAR WHEELS WITH SUSPENSION (L & R
1	FUEL TANK
1	FRONT BUMPER WITH TWO FOG LIGHTS
11	TOTAL PIECES

**AUCTION NO: 4976 / MITSUBISHI (CANTER) /
CHASSIS NO: FE82EEV-501827 / MANUFACTURED YEAR: 2003**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX :Model no
1	CABIN WITH STANDED ACCESSORIES
2	RADIATOR & CONDENSOR
1	REAR DECK
2	(FRONT WHEELS WITH SUSPENSION (L & R
2	(REAR WHEELS WITH SUSPENSION (L & R
1	FUEL TANK
1	FRONT BUMPER WITH TWO FOG LIGHTS
11	TOTAL PIECES

**AUCTION NO: 4980 / MAZDA (SCRUM) /
CHASSIS NO: DG62V-453008 / MANUFACTURED YEAR: APRIL 2004**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX Model no: K6A
2	RADIATOR & CONDENSER
2	FRONT R & L WHEELS WITH SUSPENSION
2	REAR R & L WHEELS WITH SUSPENSION
1	BONNET
1	FRONT FENDER RIGHT
1	FRONT FENDER LEFT
1	FRONT HEAD LIGHT RIGHT
1	FRONT HEAD LIGHT LEFT
1	FRONT BUMPER

1	FRONT GLASS
1	FRONT DOOR RIGHT WITH SIDE MIRROR
1	FRONT DOOR LEFT WITH SIDE MIRROR
1	REAR DOOR RIGHT
1	REAR DOOR LEFT
1	REAR TAIL LIGHT RIGHT
1	REAR TAIL LIGHT LEFT
1	REAR GATE
1	REAR BUMPER
1	FRONT SEAT RIGHT
1	FRONT SEAT LEFT
1	REAR SEAT
1	DASH BOARD WITH STEARING WHEEL
1	FUEL TANK
27	TOTAL PIECES

**AUCTION NO: 4980 / MAZDA (SCRUM) /
CHASSIS NO: DG62V-453008 / MANUFACTURED YEAR: APRIL 2004**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX Model no: K6A
2	RADIATOR & CONDENSER
2	FRONT R & L WHEELS WITH SUSPENSION
2	REAR R & L WHEELS WITH SUSPENSION
1	BONNET
1	FRONT FENDER RIGHT
1	FRONT FENDER LEFT
1	FRONT HEAD LIGHT RIGHT
1	FRONT HEAD LIGHT LEFT
1	FRONT BUMPER
1	FRONT GLASS
1	FRONT DOOR RIGHT WITH SIDE MIRROR
1	FRONT DOOR LEFT WITH SIDE MIRROR
1	REAR DOOR RIGHT
1	REAR DOOR LEFT
1	REAR TAIL LIGHT RIGHT
1	REAR TAIL LIGHT LEFT
1	REAR GATE
1	REAR BUMPER
1	FRONT SEAT RIGHT
1	FRONT SEAT LEFT
1	REAR SEAT
1	DASH BOARD WITH STEARING WHEEL
1	FUEL TANK
27	TOTAL PIECES

**AUCTION NO: 4985 / ISUZU (ELF) DUMP TRUCK 1900 KG /
CHASSIS NO: NKRR66E-7439351 / MANUFACTURED YEAR: 1994**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX Model no: 4HF1
1	CABIN WITH STANDARD ACCESSORIES
2	RADIATOR & CONDENSOR
1	REAR DECK
2	(FRONT WHEELS WITH SUSPENSION (L & R
2	(REAR WHEELS WITH SUSPENSION (L & R
1	FUEL TANK
10	TOTAL PIECES

**AUCTION NO: 4977 / PEUGEOT 307CC /
CHASSIS NO: VF33BRFN83408404 / MANUFACTURED YEAR: UNKNOWN**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX :Model no
2	R & L REAR WHEELS WITH SUSPENSION
1	R & L FRONT WHEELS WITH SUSPENSION
1	DOOR RIGHT FRONT WITH SIDE MIRROR
1	DOOR LEFT FRONT WITH SIDE MIRROR
1	DOOR LEFT FRONT WITH SIDE MIRROR
1	TAIL LIGHT RIGHT
1	TAIL LIGHT LEFT
1	(REAR (DICKY
1	REAR BUMPER
1	REAR GLASS
1	FUEL TANK
10	TOTAL PIECES

**AUCTION NO: 4987 / NISSAN (MARCH) /
CHASSIS NO: BK12-151789 / MANUFACTURED YEAR: 2004**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX Model no: GR14(OE) 1386CC
2	RADIATOR & CONDENSOR
2	FRONT R & L WHEELS WITH SUSPENSION
2	REAR R & L WHEELS WITH SUSPENSION
1	BONNET
1	FRONT FENDER RIGHT
1	FRONT FENDER LEFT
1	FRONT HEAD LIGHT RIGHT
1	FRONT HEAD LIGHT LEFT
1	FRONT BUMPER WITH GRILL
1	FRONT GLASS

1	FRONT DOOR RIGHT WITH SIDE MIRROR
1	FRONT DOOR LEFT WITH SIDE MIRROR
1	REAR DOOR RIGHT
1	REAR DOOR LEFT
1	REAR TAIL LIGHT RIGHT
1	REAR TAIL LIGHT LEFT
1	REAR GATE
1	REAR BUMPER
1	FRONT SEAT RIGHT
1	FRONT SEAT LEFT
1	REAR SEAT
1	DASH BOARD WITH STEARING WHEEL
1	FUEL TANK
27	TOTAL PIECES

**AUCTION NO: 4988 / NISSAN (MARCH) /
CHASSIS NO: AK12-088842 / MANUFACTURED YEAR: 2002**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX Model no:
2	RADIATOR & CONDENSOR
2	FRONT R & L WHEELS WITH SUSPENSION
2	REAR R & L WHEELS WITH SUSPENSION
1	BONNET
1	FRONT FENDER RIGHT
1	FRONT FENDER LEFT
1	FRONT HEAD LIGHT RIGHT
1	FRONT HEAD LIGHT LEFT
1	FRONT BUMPER WITH GRILL
1	FRONT GLASS
1	FRONT DOOR RIGHT WITH SIDE MIRROR
1	FRONT DOOR LEFT WITH SIDE MIRROR
1	REAR DOOR RIGHT
1	REAR DOOR LEFT
1	REAR TAIL LIGHT RIGHT
1	REAR TAIL LIGHT LEFT
1	REAR GATE
1	REAR BUMPER
1	FRONT SEAT RIGHT
1	FRONT SEAT LEFT
1	REAR SEAT
1	DASH BOARD WITH STEARING WHEEL
1	FUEL TANK
27	TOTAL PIECES

**AUCTION NO: 4983 / MATIZ (DAIWO) /
CHASSIS NO: KLA4MIIBCIC575356 / MANUFACTURED YEAR: UNKNOWN**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX Model no: F8CV
2	RADIATOR & CONDENSOR
2	FRONT R & L WHEELS WITH SUSPENSION
2	REAR R & L WHEELS WITH SUSPENSION
1	(BONNET (DENT
1	(FRONT FENDER RIGHT (DAMAGED
1	FRONT FENDER LEFT
1	(FRONT HEAD LIGHT RIGHT (DAMAGED
1	FRONT HEAD LIGHT LEFT
1	FRONT BUMPER WITH FOG LIGHTS
1	FRONT GLASS
1	FRONT DOOR RIGHT WITH SIDE MIRROR
1	FRONT DOOR LEFT WITH SIDE MIRROR
1	REAR DOOR RIGHT
1	REAR DOOR LEFT
1	REAR TAIL LIGHT RIGHT
1	REAR TAIL LIGHT LEFT
1	REAR GATE
1	REAR BUMPER
1	FRONT SEAT RIGHT
1	FRONT SEAT LEFT
1	REAR SEAT
1	DASH BOARD WITH STEARING WHEEL
1	FUEL TANK
27	TOTAL PIECES

**AUCTION NO: 4975 / BMW /
CHASSIS NO: WBAET76050NJ68682 / MANUFACTURED YEAR: UNKNOWN**

NO OF PCS	DESCRIPTION
1	ENGINE WITH GEAR BOX Model no: A075H159N46B20A4
2	RADIATOR & CONDENSOR
1	FRONT FENDER RIGHT
1	FRONT FENDER LEFT
1	DOOR RIGHT FRONT WITH SIDE MIRROR
1	DOOR RIGHT REAR
1	DOOR LEFT FRONT WITH SIDE MIRROR
1	DOOR LEFT REAR
1	(REAR GATE (DICKY
1	REAR BUMPER
1	FRONT GLASS
1	TAIL LIGHT RIGHT

މުވައްޖު ވަނަ ބައި 04 ވަނަ ބައި
 04 ވަނަ ބައި 04 ވަނަ ބައި

ސަރުކާރު: 113-CC/I-2010/264

އިތުރު

- 1. 04 ވަނަ ބައި 04 ވަނަ ބައި 04 ވަނަ ބައި
- 2. 04 ވަނަ ބައި 04 ވަނަ ބައި 04 ވަނަ ބައި
- 3. 05:00 ވަނަ ބައި 05:00 ވަނަ ބައި 05:00 ވަނަ ބައި
- 4. 05:00 ވަނަ ބައި 05:00 ވަނަ ބައި 05:00 ވަނަ ބައި
- 5. 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި
- 6. 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި
- 7. 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި
- 8. 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި
- 9. 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި
- 10. 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި 08:00 ވަނަ ބައި

އިތުރު 04 ވަނަ ބައި (www.port.com.mv) 04 ވަނަ ބައި 04 ވަނަ ބައި

ސަރުކާރު (ނ)	މުވައްޖު	އަދަދު	ސަރުކާރު
			100.00 ރުފިޔާ
2,584.00	ART NO. 3556 639 (Severing Brand) Model: CL382 (03kg) Max: 1600W (V:220)	04	4079

13 ސަބަބު 1431
 22 ސަބަބު 2010

ገንዘብ አገልግሎት

የገንዘብ አገልግሎት

28 ነጠብያው 2010 ዓ.ም. የገንዘብ አገልግሎት ማስገባት ደንብ
የገንዘብ አገልግሎት ማስገባት ደንብ 14:00 ሰዓት ለገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ (የገንዘብ አገልግሎት ማስገባት ደንብ)
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ (የገንዘብ አገልግሎት ማስገባት ደንብ)
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 3317070 - 3322433 - 3335547
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

የገንዘብ አገልግሎት

ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 4 ነጠብያው
1 ነጠብያው ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

28 ነጠብያው 2010 ዓ.ም. የገንዘብ አገልግሎት ማስገባት ደንብ
1 ነጠብያው ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 3317070 - 3322433 - 3335547
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

22 ነጠብያው 2010

የገንዘብ አገልግሎት: B-81/2010

ገንዘብ አገልግሎት

የገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

የገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 29 ነጠብያው
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 02 ነጠብያው
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ (21 ነጠብያው 2010)
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 16:00 ሰዓት
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 6780036
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 07 ነጠብያው
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 14:00 ሰዓት
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

1. 524 ነጠብያው ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

2. ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 6780036
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 30%
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 5%
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ 60%
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

ገንዘብ አገልግሎት ማስገባት ደንብ
ገንዘብ አገልግሎት ማስገባት ደንብ

12 ነጠብያው 1431

21 ነጠብያው 2010

IL-AS/2010/50

1431

21

23
2010

1431

21

(IU)D-2010/23

1431

21

1. ...

2. ...

3. ...

4. ...

1431

21

1000000000
 2000000000

25 2010
 2000000000

(A) CA-2010/27

1000000000

2000000000
 2000000000

2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000

1000000000	2000000000
2000000000	1000000000
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	

2000000000
 2000000000
 2000000000
 2000000000

2000000000	2000000000
2000000000	1000000000
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	
2000000000	

2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000
 2000000000

1431 13 2010
 21

1431 13 2010	21
--------------	----

1431 13 2010
 21

1431 13 2010	21
--------------	----

1431 13 2010
 21

ADM-MPL/2010/50

1431 06 2010
 15

සමස්ත තැන්පත් කිරීමේ ක්‍රියාවලියේ
සමස්ත ක්‍රියාවලිය.

LC/2010/39: සම්බන්ධයෙන්

ආරම්භය

මෙහිදී කැරණිකව පවත්වා ගැනීමේ ක්‍රියාවලියේ
විදි සහ ක්‍රියා මාර්ග පිළිබඳව විධිමත් කිරීමේ
අරමුණ මෙහිදී සඳහන් කර ඇත. මෙහිදී
15 ක්‍රියා මාර්ග සඳහා විධිමත් කිරීම්
විස්තරයෙන් සඳහන් කර ඇත.

- 01. සමස්ත ක්‍රියාවලියේ විධිමත් කිරීම්
02. සමස්ත ක්‍රියාවලියේ විධිමත් කිරීම්

22 වන කොටස 2010

සමස්ත තැන්පත් කිරීමේ ක්‍රියාවලියේ
සමස්ත ක්‍රියාවලිය.

LC/2010/37: සම්බන්ධයෙන්

ආරම්භය

මෙහිදී කැරණිකව පවත්වා ගැනීමේ ක්‍රියාවලියේ
විදි සහ ක්‍රියා මාර්ග පිළිබඳව විධිමත් කිරීමේ
අරමුණ මෙහිදී සඳහන් කර ඇත. මෙහිදී
15 ක්‍රියා මාර්ග සඳහා විධිමත් කිරීම්
විස්තරයෙන් සඳහන් කර ඇත.

- 01. සමස්ත ක්‍රියාවලියේ විධිමත් කිරීම්

19 වන කොටස 2010

ආණ්ඩුක්‍රමලේඛන කොමිෂන්
වලින් පැහැදිලි කිරීම

(A)AC-2010/30: සම්බන්ධයෙන්

ආරම්භය

විධිමත් කිරීම් සහ ක්‍රියා මාර්ග පිළිබඳව

මෙහිදී කැරණිකව පවත්වා ගැනීමේ ක්‍රියාවලියේ
විදි සහ ක්‍රියා මාර්ග පිළිබඳව විධිමත් කිරීමේ
අරමුණ මෙහිදී සඳහන් කර ඇත. මෙහිදී
9 ක්‍රියා මාර්ග සඳහා විධිමත් කිරීම්
විස්තරයෙන් සඳහන් කර ඇත.

30 වන කොටස 2010 ට 15:00 දක්වා විධිමත් කිරීම්
විස්තරයෙන් සඳහන් කර ඇත. මෙහිදී
www.elections.gov.mv දින 18 දක්වා විධිමත් කිරීම්

- 1. 18 දිනක් විධිමත් කිරීම්
2. සෞඛ්‍ය අංශයේ විධිමත් කිරීම්

12 කොටස 1431
21 වන කොටස 2010

Երևանի մարզի կրթության նախարարություն
 Երևանի մարզի կրթության նախարարության կողմից կազմակերպվող մրցույթի և մեծ
 ծախսերի մասին

Մրցույթի համար: 3341215, Գնահատման համար: 3320206

Մրցույթի համար: (IUL)22-AP/1/2010/1053

Նպատակ

Երևանի մարզի կրթության նախարարության կողմից (IUL)22-AP/1/2010/1015 (20 օգոստոսի 2010) և մրցույթի ռեզուլտատները կրթության նախարարության կողմից:

Մրցույթի մասին կրթության նախարարության կողմից կազմակերպվող մրցույթի մասին և մրցույթի ռեզուլտատները կրթության նախարարության կողմից:

2010 թվականի 27 հունիսի 27-ին կատարվող մրցույթի մասին:

1. Առաջին փուլի մրցույթի մասին
2. Առաջին փուլի մրցույթի մասին
3. Առաջին փուլի մրցույթի մասին

Մրցույթի մասին կրթության նախարարության կողմից կազմակերպվող մրցույթի մասին և մրցույթի ռեզուլտատները կրթության նախարարության կողմից:

Կրթության նախարարության կողմից կազմակերպվող մրցույթի մասին և մրցույթի ռեզուլտատները կրթության նախարարության կողմից:

07 հունիսի 1431
 16 հունիսի 2010

Երևանի մարզի կրթության նախարարություն
 Երևանի մարզի կրթության նախարարության կողմից

Մրցույթի համար: 2010/42

Նպատակ

Երևանի մարզի կրթության նախարարության կողմից կազմակերպվող մրցույթի մասին և մրցույթի ռեզուլտատները կրթության նախարարության կողմից:

Մրցույթի մասին կրթության նախարարության կողմից կազմակերպվող մրցույթի մասին և մրցույթի ռեզուլտատները կրթության նախարարության կողմից:

2010 թվականի 15 օգոստոսի 15-ին կատարվող մրցույթի մասին:

Կրթության նախարարության կողմից կազմակերպվող մրցույթի մասին և մրցույթի ռեզուլտատները կրթության նախարարության կողմից:

13 հունիսի 2010

דברנו וברסנו

ד"ר רחמי שטיינבערג, ראש מרכז המידע

מספר האישור: 1000

ד"ר, מרצה: ד"ר רחמי שטיינבערג

CR-NB/2010/11: מספר: 11/2010

דברנו וברסנו

ד"ר רחמי שטיינבערג, ראש מרכז המידע, מרצה: ד"ר רחמי שטיינבערג, ראש מרכז המידע

מרכז המידע של משרד הבריאות מודאג מאוד מהתגברות נגיף האיידס בישראל. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות.

נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות.

נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות.

נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות. נגיף האיידס הוא נגיף המזיק את מערכת החיסון של הגוף, ומאפשר לנגיפים אחרים להיכנס לגוף ולגרום למחלות שונות.

11 שעות 1431
21 שעות 2010

• אישור: 3335209 0

